


રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ-રાજકોટ

શ્રી જીમનભાઈ પટેલ વિકાસ ભવન, પો. બો. નં.-૨૩૮, જામનગર રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧.

-: બાંધકામના વિકાસ માટેની પરવાનગી :-



પ્રકારગ ક્રમાંક : નં. ૩૩/ટેક/૩૪/મીટીંગ/૬૭૧/૧૯/૫૨૩૭ તા. ૨૩ - ૦૮ - ૨૦૧૯

સી વિદ્યુત્તમભાઈ રાયધનભાઈ હુંબલ

નામ : ૮૦ મનદાપ વૈજલ, "રાધલ" ગુલાબ વિહાર સોસાયટી શેરી નં. ૬

સરનામું : જાગ જાગર ના યાજ્ઞ રાજકોટ

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ (સને-૧૯૭૬ નો રાષ્ટ્રપતિ અધિનિયમ નંબર-૨૭) ની કલમ-૨૬, ૨૭, ૨૮ (૧) અને ૩૪, ૪૯, પ્રમાણે બાંધકામ વિકાસ પરવાનગી, પાછળ જાગાવેલ તેમજ નીચે જાગાવેલી ખાસ શરતોને અનુસરીને મોજે : ગામ-મીરોડા તાલુકો- લોધિકા

— નાં સર્વે નં.- ૪૫૫૫૯ ટી.પી.એસ.નં.- — એફ.પી. નં.- —

ના પ્લોટ નં.- (૩૬) સબ પ્લોટ નં.- — ના ક્ષેત્રફળ (ચા.મી.) ૨૯૬' ૨૫ માં ૨ હેક્ટર હેતુ માટે તમારી હદમાં તમારા જોખમે આપવામાં આવે છે.

ગમનું વર્ણન :- ડવેલોપ-૩ ના ૨ હેક્ટર હેક્ટરમાં બાંધકામ પ્લાન. (સીટી ૬૫૬ ફ્લોર ૨)

બાંધકામનો પ્રકાર	બાંધકામનું ઉપયોગી ક્ષેત્રફળ ચો.મી.	બાંધકામની	રીમાર્ક્સ
		સંખ્યા	
૨ હેક્ટર ડવેલોપ-૩ નાં હેતુ માટે	GF - ૨૭૯, ૨૬ FF - ૨૭૯, ૨૬ 2nd - ૨૭૯, ૨૬ 3rd - ૨૭૯, ૨૬ 4th - ૨૭૯, ૨૬ 5th - ૨૭૯, ૨૬ STAIR - ૦૨૪, ૮૦	(૨)	(૧) ફૂલ પ્લોટ ફોટફળ - ૨૯૬, ૨૫ ચો.મી.
અમોલગમેશન/ સબ પ્લોટીંગ/ બાંધકામ પ્લાન	કુલ બાંધકામ, ૧૦૯૯, ૭૬	એક	(૨) ફૂલ બાંધકામ ફોટફળ - ૧૦૯૯, ૭૬ ચો.મી.



માં પાર્ટીંગ છે.
ફૂલ મળીને, (૧૦) ફ્લોર છે.

(૧) લોડેડના આયોજન મુજબ મુજબ કરવાના રહેશે.

ખાસ શરતો :- (૧) ડિમંડ પ્રવાણી મુજબ, સ્થાયી વૃક્ષો વાવવા માવજત કરવાના રહેશે, આ વૃક્ષો વાવવાની વજાલના નેમજો બાંધકામના ૨ હેરો,

૧. નગર રચના યોજના નં. — ટી. પી. ઓ. શ્રી દ્વારા અંતિમ કરતાં જે કાંઈ ફેરફાર થશે તે બંધનકર્તા રહેશે. (૨) ફાઇનલ મુજબ કરવાના રહેશે, આ નવા વજા કામના રાખું કરવાના રહેશે.
૨. માલિકી પુરતી જમીનના રીવાઈઝડ બાંધકામના પ્લાન ડવેલોપ-૩ હેતુ માટેનો ઉપર દર્શાવ્યા મુજબના વપરાશ માટે જ મંજૂર કરવામાં આવે છે. ૨ હેક્ટર (સીટી ૬૫૬ ફ્લોર ૨)
૩. માલિકી પુરતી જમીનની એક્ટ્રીકરણ ફી રૂ. — વસુલ કરી એક્ટ્રીકરણ પણ મંજૂર કરવામાં આવેલ છે. (૨) ડિમંડ પ્રવાણી મુજબ કરવાના રહેશે. તેમજ કામના રાખું કરવાના રહેશે.
૪. સબ પ્લોટીંગ તથા બાંધકામ પ્લાન માટેની અરજ અન્વયે ડેવલપમેન્ટ ચાર્જના રૂ. ૭૫૩૬/- તથા રૂ. — મળી કુલ રૂ. ૭૫૩૬/- તા. ૧૭ - ૦૬ - ૨૦૧૯ થી ભરપાઈ કરેલ છે.
૫. બાંધકામ પ્લાન અન્વયે થતી સર્વિસ એમેનીટી ફી રૂ. ૩૨૫૯૨૬/- તા. ૨૬/૮/૨૦૧૬ થી ભરપાઈ કરેલ છે. અને પ્લોટમાં વૃક્ષો વાવવા/જાળવવા અંગેની ટ્રી પ્લાન્ટેશન ડીપોઝીટ પણ ભરપાઈ થયેલ છે.

૬. માલિકી પુરતી જમીનના સબ પ્લોટીંગ પ્લાન/બાંધકામ પ્લાન રેગ્યુલરાઇઝેશન ફી રૂ. વસુલ કરી રેગ્યુલરાઇઝ કરી મંજૂર કરવામાં આવે છે.
૭. પ્લાનમાં દર્શાવ્યા મુજબના માર્જન છોડવાના રહેશે.
૮. અત્રેથી અપાયેલ અગાઉની તા.ની પરવાનગી હવેથી રદ થયેલ ગણાશે.
૯. નગર રચના યોજના નં. અન્વયે બેટરમેન્ટ ચાર્જ રૂ. તા. નાં રોજથી વસુલ કરેલ છે.
૩૦. માલિકીની જમીનમાં ખાળકુવો બનાવી તેમાં શૌચાલયના ગંદા પાણીનો નિકાલ કરવાનો રહેશે. તેમજ રેઇન વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ બેસાડવાની રહેશે. જે અંગે અત્રેથી ખરાઇ કરવી લેવાની રહેશે.
૧૧. સ્થાનિક સંસ્થા ગ્રામ પંચાયત મોડેલ ની રજૂ ચીઠ્ઠી લેવાની રહેશે. જે ઓક્યુપન્સી સર્ટીફિકેટ મેળવતા પહેલા અત્રે રજૂ કરવાની રહેશે.
૧૨. સ્ટ્રક્ચરલ ડિઝાઇન તથા ડ્રોઇંગ, એસ.બી.સી. રીપોર્ટ અને ફોર્મ નં. - ૧૨ તમામ વિગતો સાથે અત્રે રજૂ કરાયેલ છે. જેની તમામ જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે.
૧૩. બાંધકામ મટીરીયલ્સ ટેસ્ટીંગ રીપોર્ટ તથા બાંધકામ અંગેનો પ્રગતિ અહેવાલ સમયાંતરે અત્રે રજૂ કરવાના રહેશે. સરકારશ્રીના તા. ૨૯-૫-૨૦૦૧નાં ઠરાવની તથા ત્યારબાદની વખતો વખતની જોગવાઈને આધીન બાંધકામ વિકાસ પરવાનગી મુજબ બાંધકામ કરવાનું રહેશે.
૧૦. મંજૂર થયેલ બાંધકામ વિકાસ પરવાનગી મુજબ બાંધકામ કરવાનું રહેશે. જેમાં કોઇપણ ફેરફાર કરી શકાશે નહીં. અન્યથા અત્રેથી રીવાઇઝડ વિકાસ પરવાનગી મેળવી લેવાની રહેશે.
૧૫. બાંધકામ અંગેના સ્ટ્રક્ચરલ અંગેની તમામ જવાબદારી સ્ટ્રક્ચરલ એન્જનીયરશ્રી/એન્જનીયરશ્રી તથા અરજદારશ્રીની રહેશે. જે અંગે રૂડાની કોઇ જવાબદારી રહેશે નહીં.
૧૬. જી. ડી. સી. આર. ની પ્રવર્તમાન જોગવાઈ મુજબ ફાયર સેફ્ટીની જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. અને તે મુજબ સમગ્ર આયોજન પણ કરવાનું રહેશે. તથા ઉદ્યોગમાંથી નિકળતા વેસ્ટના નિકાલ અંગેની યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે. અને ઉદ્યોગમાંથી નિકળતા ગંદા પાણીના નિકાલ માટે જરૂરી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની વ્યવસ્થા પણ કરવાની રહેશે. મંજૂર થયેલ હેતુ સિવાય અન્ય કોઇ માટે ઉપયોગ કરી શકાશે નહીં તથા ઉપયોગ કરતા પહેલા સરકારશ્રીના અન્ય વિભાગ / નિગમ બોર્ડની અન્યોની જરૂરી રહેતી તમામ મંજૂરીઓ / એન. ઓ. સી. મેળવી લેવાની જવાબદારી તમોની / માલિકની રહેશે.
૧૭. મંજૂર થયેલ હેતુ સિવાય અન્ય કોઇ હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં. અન્યથા અપાયેલ વિકાસ પરવાનગી આપોઆપ રદ થયેલ ગણાશે.
૧૮. મંજૂર થયેલ લે-આઉટ મુજબ સ્થળે બાહ્ય હદ માપો / ક્ષેત્રફળો ની અધિકૃત ખરાઇ કરી સ્થળે મેળવી. લેવાની સમગ્ર જવાબદારી એન્જનીયરશ્રી/આર્કિટેકશ્રી તથા અરજદારશ્રીની રહેશે.

૧૯. આ સાથેની કુલ (૧) થી (૧૩) થી જણાવેલ ચારતોનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

૨૦ - (કોઈપણ પ્રકારના જોગવાઈઓની જોડે જોડે રજૂ કરી અન્યથા)

નકલ રવાના પ્રતિ,

(૧) નગર રચના અધિકારીશ્રી

ન.ર.ચો.નં.

યુનિટ નં. જુની રૂડા બિલ્ડીંગ, રાજકોટ

(૨) તલાટી ક્રમ મંત્રીશ્રી

મોજે મોડેલ..... તા. ૨૦/૦૫/૨૦૨૦

બિડાણ :- ઉપર મુજબ



A.R.Pani

જુનીયર નગર નિયંત્રક
પહેલી વિકાસ સત્તાપંદળ
રાજકોટ

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ ધારો - ૧૯૭૬ ની કલમ - ૨૬, ૨૯ અને ૪૯ ની શરતો

૧. વિકાસ નકશા તથા નગર રચના યોજના વિસ્તારમાં જમીન આવેલ હશે તો ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬ ની કલમ - ૨૬, ૨૯ અને ૪૯ માં જણાવ્યા પ્રમાણેનું કોઈપણ વિકાસ કામ કરતા પહેલા, રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની જરૂરી મંજૂરી મેળવી જરૂરી છે. લેન્ડ રેવન્યુ કોડની કલમ - ૬૫ પ્રમાણે જમીનોની બિન ખેતી ઉપયોગ શરૂ કરતા પહેલા કલેક્ટરશ્રી અથવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અથવા સંબંધિત સક્ષમ અધિકારીશ્રીની જરૂરી પરવાનગી મેળવવી જરૂરી છે.

૧. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬ ની કલમ - ૨૬, ૨૯, અને ૪૯ પ્રમાણે :

૧. (અ) વિકાસ નકશાની અને નગર યોજનાની દરખાસ્ત અને રેગ્યુલેશનોને અનુસરી મકાન બાંધવું પડશે.
૨. (બ) મકાન બાંધકામની રજા, સર્વે નંબર અગર અંતિમ ખંડ અગર એવી જમીનમાં મંજૂર થયેલા લે-આઉટનાં સબ પ્લોટ જો માલિકના કબજામાં હશે તો આપવામાં આવશે.

૧. (અ) ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ મુજબ વિકાસ નકશાના તથા નગર રચના યોજનાની રેગ્યુલેશનની રૂએ જે કોઈ અંકુશો તથા શરતો મુકવામાં આવ્યા હોય તેનાથી જો કોઈ નુકશાન થાય તેમ હોય તો આ નુકશાનનો કોઈ પણ બદલો માગ્યા સિવાય માલિક તે મુજબ શરતોનો અમલ કરશે.

૨. (બ) ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૨૬, ૨૯, અને ૪૯ મુજબ આપેલી વિકાસ માટેની પરવાનગીમાં જે શરતો મૂકી હશે તે તમામ શરતો પણ માલિક પાળવાની રહેશે.

૩. જો બિલ્ડીંગ પ્લોટનાં આકાર બદલવામાં આવશે તો માલિકને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬ મુજબ મળી શકે સિવાય વિશેષ કાંઈપણ બદલો બિલ્ડીંગ પ્લોટના ભાગલા પાડવા બદલ મળી શકશે નહીં.

૪. માલિકને વિકાસ માટેની પરવાનગી આપવામાં આવી હશે તો પણ તેમણે ગુજરાત રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬ મુજબ નગર રચના યોજના માટે ફાળો આપવો પડશે/બેટરમેન્ટ ચાર્જ ભરવાનો રહેશે.

૫. નગર રચના યોજના મુજબના ફાળાની ગણતરીના હેતુ માટે ફક્ત ખુલ્લી જમીન એટલે કે તે જમીન ઉપર કોઈ જાતનું બાંધકામ નથી તેમ સમજીને તેને નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમની કલમ લાગુ પડશે.
૬. વિકાસ પરવાનગી અંદર બતાવેલી શરતોમાંની કોઈપણ શરતોનો ભંગ કરવામાં આવશે તો શહેરી વિકાસ સત્તામંડળ શરતોનો અમલ કરવી શકશે અને શહેરી વિકાસ સત્તામંડળના તેવા કૃત્યને લીધે જે કોઈ નુકશાન, ખોટ કે હરકત માલિકને થાય તે અંગે બદલો મળી શકશે નહીં.
૭. વિકાસ નકશાના અને નગરરચના યોજના જુદા-જુદા વિસ્તારમાં જમીનો અને મકાનોના ઉપયોગ વિશે જે ખાસ નિયમો હશે તેની વિરૂધ્ધનો ઉપયોગ કરી શકશે નહીં. તેમજ રજા માગતી વખતે નકશાના દરેક ખંડના ઉપયોગ દર્શાવ્યા હશે તે ઉપયોગ અગાઉથી મંજૂરી લીધા સિવાય કરી શકશે નહીં.
૮. વિકાસ નકશાના તથા નગર રચના રેગ્યુલેશનો હેઠળ આપવામાં આવેલ બાંધકામની પરવાનગી શહેરી વિકાસ સત્તામંડળના મંજૂરીના હુકમની તારીખથી એક વર્ષ માટે માન્ય રહેશે અને ત્યારબાદ વખતો વખત રીન્યુ કરવામાં નહીં આવે તો તે રદ થયેલ ગણાશે.
૯. જમીનમાં દર ૮૦ ચોરસ મીટરે એક ઝાડ ઉગાડવાનું રહેશે.
૧૦. ઉપર જણાવેલી શરતોનો ભંગ કરવા બદલ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬ ની કલમ - ૯૮ પ્રમાણે ફરીયાદ કરવામાં આવશે. અને તે ભંગ બદલ તેમાં જણાવ્યા પ્રમાણે દંડને પાત્ર ગણાશે.
૧૧. સદર પરવાનગી જી. ડી. સી. આર. અન્વયે આપવામાં આવે છે. તેમજ સ્થાનિક સંસ્થા પાસેથી રજા ચીઠ્ઠી મેળવવાની રહેશે.
૧૨. તમારા પ્લોટની હદમાં ખાળકૂવો કરવાનો રહેશે. કે જે અત્રેથી નિરીક્ષણ કર્યાબાદ ઢાંકવાનો રહેશે.
૧૩. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તેમજ અન્ય સંબંધિત કચેરી સંસ્થા પાસેથી જરૂરી પરવાનગી **NOC** મેળવ્યા બાદ જ બાંધકામ કરવાનું રહેશે.
૧૪. વિકાસ પરવાનગી નિયત સમય મર્યાદામાં રીન્યુ કરવાની રહેશે. અન્યથા પેનલ્ટી ભરવાની રહેશે.
૧૫. બાંધકામના સ્થળે બાંધકામ અંગેની તમામ વિગતો ગુજરાતી ભાષામાં બોર્ડમાં દર્શાવવાની રહેશે.
૧૬. સોલાર વોટર હીટીંગ સીસ્ટમ ની વ્યવસ્થા કરવાની રહેશે.



तालुको : लोधीका .

જીલ્લો : રાજકોટ

nl. 29/5/2016

1. 4326192413 9300

૫૭૧/૧૪/૬૨૩૭ વા. ૨૩/૧૧/૧૪
પંચાયત ધારાની કલમ-૧૦૪ મુજબની ચૂંટણી પરવાનગી

શ્રી. પિરમ. મ. ડ. રા. પા. મ. ડ. ડી. મ. મ.

રહે. ૨૧.૦૩.૧૮

આપની તા. ૨૭.૧.૧૯૭૮ ના રોજની અરંજીમાં જણાવ્યા મુજબ મોજે
..... ૨૬.૧.૧૯૭૮ ગામની તમારા કબજા ભોગવટની જુના / નવા મામતબની / રહેણાંક / ઔદ્યોગિક હેતુ
માટે બીનખેતી થયેલ જમીન ઉપર બાંધકામ કરવાની મંજૂરી માંગતા નીચે દર્શાવેલ જમીન ઉપર ગુજરાત ગ્રામ
પંચાયત ધારાની કલમ-૧૦૪ અન્વયે ગ્રામ પંચાયતને મળેલ અધિકારની રૂએ નીચેની શરતોને આધિન રહીને
બાંધકામ પરવાનગી આપવામાં આવે છે..

-: જામીન પત્ર નં - ચાંગે					
સુભાગ્યપૂર્ણ સ્થળોએ મુજબ આદેશ છે			લાઇડામ	(૧) કુલ જમીન	૨૫૬૨૫
આઈડામના	G.F	૧૭૮-૧૬	નાસ્વા	મોરબી	
પરીચ	F.I.	૧૭૮-૧૭	૧	૨૫૬-૨૪ ચોરસ	
સ્થળોએ	2th	૧૭૮-૧૭	અડે		
કયામાં ૩	3th	૧૭૮-૧૬		૨, કુલ લાઇડામ	
અમારા મોળ /	4th	૧૭૮-૧૬		ફાયર	
સાવધાનો)	STI2	૦૦૪ ૮૦		૧૦૫૦-૭૬ ચોરસ	
લાઇડામ					

[illegible]

શરતો :-

- (૧) પંચાયતને આપેલ રજાચીકી માત્ર તમારી માલીકી અને કબજા ભોગવટાની જમીનમાં બાંધકામ કરવા પુરતી છે.
- (૨) પરવાનગી મળ્યા તારીખથી બાંધકામ એક માસમાં ચાલુ કરવાનું રહેશે અને વર્ષમાં પુરૂ કરવાનું રહેશે.
- (૩) પરવાનગીની મુદત રજાચીકી આપ્યાની તારીખથી એક વર્ષની રહેશે પછી આપોઆપ રદ ગણાશે.
- (૪) બીનખેતી થયેલ જમીન હશે તો બીનખેતી હુકમમાં તથા સનંદમાં દર્શાવેલ શરતોનું પાલન કરવાનું રહેશે.
- (૫) સરકારશ્રીની અથવા બીજી કોઈ ખાનગી મિલકતને કાંઈ નુકશાન થશે તો તેની જવાબદારી રજાચીકી મેળવનારની રહેશે.

(૬) ઉદ્યોગ તથા પ્રદુષણ બોર્ડની શરતોનું પાલન કરવાનું રહેશે.
 (૭) જુના રસ્તા તથા પાણીના વહેણનો મારગ બંધ કરી શકાશે નહિ.
 (૮) રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ રાજકોટના પત્રોમાં જણાવ્યા મુજબ શરતોનું પાલન કરવાનું રહેશે. અને બાંધકામ પૂર્ણ થયે કમ્પ્લીશન સર્ટી. મેળવી ઉપયોગ કરવાનો રહેશે.

ઉપરોક્ત શરતોનો ભંગ થયે બાંધકામ પરવાનગી રદ થવા પાત્ર છે. ઉપરોક્ત તમામ શરતોને આધિન રહીને બાંધકામ પરવાનગી આપવામાં આવે છે.

dl. 291679 ✓

SMRITESH VERMA 99

सुरपंथ
श्री १११ पंथायत्त